

ધી બરોડા સીટી કો – ઓપરેટીવ બેંક લી.

સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા. – ૩૯૦૦૦૧

લોકર એગ્રીમેન્ટ

શાખા:—

લોકર નંબર:—

આ લોકર એગ્રીમેન્ટ ("કરાર") બેંક અને તેના ગ્રાહક વચ્ચે અહીં શેડયુલમાં જણાવ્યા મુજબ સ્થાન પર અને તારીખે કરવામાં આવેલ છે.

"બેંક" શબ્દમાં તેના અધિકારીઓ, અનુગામીઓ, ઉત્તરાધિકારીઓ, પ્રશાસકો, પ્રબંધક અને પ્રબંધકર્તાઓ (ASIGS) સોંપણીઓ નો સમાવેશ થાય છે અને "ગ્રાહક" શબ્દમાં સમાવેશ થશે, જ્યાં ગ્રાહક:—

- એક અથવા વધુ વ્યક્તિઓ, તેના / તેણીના / તેમના વારસદાર (રો), વહીવટકર્તા(ઓ) અને કાનુની પ્રતિનિધિ (ઓ), પ્રશાસક (કો), કાનુની વારસદાર (રો) હોય ;
 - માલીકી પેઢી, માલીક અને તેના / તેણીના વારસદારો, વહીવટકર્તા(ઓ), સંચાલક(ઓ), પ્રશાસક (કો) અને કાનુની પ્રતિનિધિ(ઓ) હોય ;
 - ભાગીદારી પેઢી, આવી પેઢી અને તેના અનુગામી, ઉત્તરાધિકારીઓ, આવી પેઢીના ભાગીદારો, તેમની વચ્ચે બાકી રહી ગયેલા ભાગીદારો અથવા / તથા વહીવટકર્તા(ઓ), તેના ઉત્તરાધિકારી આવી પેઢીના ભાગીદારો તે પૈકીના ઉત્તરાધિકારી કે ઉત્તરાધિકારીઓ, અને વારસદાર (રો) વહીવટકર્તા (ઓ) પ્રશાસક (કો) તેમના પ્રત્યેકના કાનુની વારસદારો અને કાનુની પ્રતિનિધિ(ઓ) હોય ;
 - હિંદુ અવિભક્ત કુટુંબ(અંચ.યુ.એફ.), તેના સભ્યો અને તેમના બાકી રહી ગયેલા સભ્યો તેમના ઉત્તરાધિકારી (ઓ), કાનુની વારસ (સો) વહીવટકર્તા(ઓ), પ્રશાસક (કો) અને કાનુની વારસદાર (રો) કાનુની પ્રતિનિધિ(ઓ) હોય ; અને
 - લીમીટેડ કંપની તેના અનુગામી(ઓ) અને ઉત્તરાધિકારી (ઓ) હોય તથા વીગેરે હોય ;
- જ્યારે: (બેંક અને ગ્રાહક દરેકને "પક્ષકાર" અને સામૂહિક રીતે "પક્ષકારો" તરીકે સંદર્ભ કરવામાં આવેલ છે.)
- સેઈફ ડીપોઝીટ લોકર સુવિધાનો લાભ લેવાની ઈચ્છા ધરાવતા ગ્રાહકે આવી સુવિધા મેળવવા માટે બેંકનો સંપર્ક કર્યો છે;
 - કેટલાક નિયમો અને શરતોને આધીન રહીને ગ્રાહકને સેફ ડીપોઝીટ લોકર સુવિધા પુરી પાડવા માટે બેંક સહમત છે અને
 - પક્ષકારોએ આ સંબંધમાં તેમની વચ્ચે સમજૂતી નક્કી કરીને કરાર કર્યો છે.

નીચે પ્રમાણેના નિયમો તથા શરતો માટે બન્ને પક્ષકારો સંમત થાય છે:

- લોકર લાઈસન્સ:—
 - લાયસન્સર તરીકે બેંક આથી ગ્રાહકને લાયસન્સ ધારક તરીકે, સેફ ડીપોઝીટ લોકરનો ઉપયોગ કરવા માટેનું લાઈસન્સ આપે છે. આને આધીન આ કરાર (ત્યારબાદ તેને લોકર કરાર તરીકે ઓળખવામાં આવશે) હેઠળ નિર્ધારિત નિયમો અને શરતો જેની વિગતો આ કરારની શેડયુલમાં વધુ ખાસ રીતે વર્ણવવામાં આવી છે.
 - ગ્રાહક આથી અનુસૂચિમાં ઉલ્લેખિત શરતોમાં આપવામાં આવેલ લાયસન્સ ફી (ભાડું) સ્વીકારે છે.
 - આ દ્વારા આપવામાં આવેલ લાઈસન્સ લોકરનો ઉપયોગ કરવા માટેનું છે:
 - વ્યક્તિગત અને ગ્રાહકના પોતાના ઉપયોગ માટે, ગ્રાહક સિવાય અન્ય કોઈ વ્યક્તિના ઉપયોગ માટે નહીં;
 - બિન – તબદીલી પાત્ર;
 - માત્ર કાયદેસરના હેતુઓ માટે જેમ કે દાગીના અને દસ્તાવેજો જેવી કિંમતી ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે પરંતુ કોઈ રોકડ અથવા ચલણ સંગ્રહિત કરવા માટે નહીં;
 - સ્ટોર કરવા માટે નથી:
 - શસ્ત્રો, વિસ્ફોટકો, દવાઓ અને/અથવા કોઈપણ પ્રતિબંધિત સામગ્રી; અને/અથવા
 - કોઈ પણ નાશવંત સામગ્રી અને/અથવા કિરણોત્સર્ગી સામગ્રી અને/અથવા કોઈપણ ગેરકાયદેસર પદાર્થ; અને/અથવા
 - કોઈપણ સામગ્રી જે બેંક અથવા તેના કોઈપણ ગ્રાહકો માટે કોઈપણ જોખમ અથવા ઉપદ્રવ પેદા કરી શકે છે.
- ગ્રાહકને આ કરાર હેઠળ ઉલ્લેખિત નિયમો અને શરતો અનુસાર લોકરને ઓપરેટ કરવા અને તેનો ઉપયોગ કરવાના અધિકાર સિવાય લોકરમાં મિલકતનો કોઈ અધિકાર રહેશે નહીં.
- ગ્રાહકને લોકર ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવશે:
 - બેંકના કામકાજના દિવસે લોકર ઓપરેટ કરવા માટે બેંક દ્વારા સમયાંતરે સુચિત કરાયેલ ચોક્કસ સમય દરમિયાન અને આવી સુચનાની ગેરહાજરીમાં બેંકના કામકાજના સમય દરમિયાન. જો કે, બેંક તેના નિયંત્રણ બહારના કોઈપણ કારણોસર જેમ કે પુર, હુલ્લડો, કક્કર્યુ, તાળાબંધી વગેરે કારણસર કામ કરવા સક્ષમ ન હોય તેવા સંજોગોમાં, બેંક લોકરને ઓપરેટ કરવાની મંજૂરી આપવા માટે જવાબદાર રહેશે નહીં;
 - ગ્રાહક બેંક દ્વારા નિર્દેશિત વિગતો નિર્ધારિત કોર્મમાં અને તેના રેકૉર્ડમાં આવી કામગીરીની વિગતો દાખલ કરે તે પછી; અને જો બેંક દ્વારા માંગવામાં આવે તો ગ્રાહક ઓળખનો પુરાવો આપે તે પછી;
 - જો બેંક દ્વારા માંગવામાં આવે તો, ગ્રાહક દ્વારા ઓળખનો પુરાવો પ્રદાન કરવામાં આવે પછી.
- ગ્રાહકના હક્કો અને જવાબદારીઓ
 - ગ્રાહકના હક્કો
 - આ કરારની શરતોને આધીન ગ્રાહકને સામાન રાખવા માટે લોકરનો ઉપયોગ કરવાનો અને બેંક દ્વારા આવા સામાનના રક્ષણ માટે વાજબી સંભાળની અપેક્ષા રાખવાનો અધિકાર રહેશે અને જો બેંક આમ કરવામાં નિષ્ફળ જાય તો સમય સમય પર લાગુ કાયદા અને નિયમો હેઠળ ઉપલબ્ધ હોય તેવા ઉપાયોનો લાભ મેળવશે.
 - બેંક સમય પર લાગુ પડતા કાયદા અને નિયમો હેઠળ ગ્રાહકના અધિકારોને સ્વીકારે છે.
 - ગ્રાહક;
 - લોકરનો ઉપયોગ ફક્ત લાગુ કાયદા અને નિયમો અનુસાર અને તે હેતુ માટે જ કરી શકશે જેના માટે તે પ્રદાન કરવામાં આવ્યું છે અને;
 - લોકર ઓપરેટ કરવા માટેના હાલના નિયમો અને/તથા સમયંતરે બેંક દ્વારા લાગુ કરવામાં આવતા નિયમોનું પાલન કરવા બંધાયેલ છે;

- (c) લોકર ખોલવા માટે બેંક દ્વારા આપવામાં આવેલી ચાવી સલામત સ્થળે રાખવી, તેને અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરવી નહીં અને તેને કોઈ અન્ય વ્યક્તિના હાથમાં ન આવવા દેવી, જેથી કરીને લોકરનો બિનઅધિકૃત ઉપયોગ થતો બચાવી શકાય;
- (d) લોકર ફક્ત બેંક દ્વારા પ્રદાન કરવામાં આવેલ ચાવી નો ઉપયોગ કરીને ખોલી શકાશે અને અન્યથા નહીં;
- (e) લોકરના સંચાલન માટે બેંક દ્વારા પુરી પાડવામાં આવેલ ચાવી સાથે ફેરફાર કરવો નહિ અથવા/તથા તેની નકલ બનાવવી નહીં;
- (f) લોકરના સંચાલન માટે બેંક દ્વારા પ્રદાન કરવામાં આવેલ ચાવી ખોવાઈ જવાના કિસ્સામાં બેંકને તાત્કાલીક લેખીતમાં જાણ કરવી;
- (g) અગાઉ બેંકને લોકરની કામગીરી માટે બેંક દ્વારા પુરી પાડવામાં આવેલ ચાવી ખોવાઈ ગયાની જાણ કરવામાં આવી હોય તેવા કિસ્સામાં જો ખોવોયેલ ચાવી મળી આવે તો બેંકને તાત્કાલીક પરત કરવી;
- (h) બાકી રહેલું ભાડું બેંકને ચૂકવવાનું રહેશે તથા બેંક દ્વારા કરવામાં આવતા તમામ ખર્ચ ઉઠાવવાનો રહેશે જેમાં સામેલ છે:
- (i) બેંક દ્વારા પુરી પાડવામાં આવેલ ચાવી ગુમાવવાની જાણ ગ્રાહક દ્વારા કરવામાં આવે તથા તેની અનુસંધાને લોકરની ચાવી બદલવી અને લોકરનું સમારકામ કરવું; અને
- (ii) આ કરારની શરતોને આધિન/ભંગ થયે લોકરને તોડવું.
- (i) સરનામું, ફોન નંબર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે સહીતની સંપર્ક વિગતો બદલાય તો ગ્રાહકે નવું સરનામું, ફોન નંબર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે સહીતની સંપર્ક વિગતો તરત જ બેંકને લેખીત માં જાણ કરવી.

૩. બેંકના અધિકારો:

૩.૧ બેંકને આનો અધિકાર રહેશે:

- (a) જો ગ્રાહક દ્વારા ભાડું અથવા/અને લોકર અંગેના અન્ય કોઈપણ ખર્ચની વસુલાત ચૂકવણી કરવામાં ન આવે તો, જ્યારે બાકી હોય ત્યારે; ગ્રાહકના ખાતામાંથી રકમ ઉધાર કરવાનો; અને
- (b) લોકરની ઓપરેશન/સંચાલનનો ઈન્કાર કરવાનો:
- (i) જો લોકર પરનું ભાડું ચૂકવ્યું ન હોય / બાકી હોય તો; અને
- (ii) જ્યારે ગ્રાહક લોકર ઓપરેટ કરવાના સમયે બેંક દ્વારા માંગવામાં આવેલ ઓળખનો પુરાવો આપવામાં નિષ્ફળ જાય છે.

૩.૨ લાયસન્સની સમાપ્તિ:

- ૩.૨.૧ આ કરાર હેઠળ ગ્રાહક દ્વારા ભંગ અથવા ડિકોલ્ટના કિસ્સામાં અને/અથવા બેંકનું માનવું છે કે ગ્રાહક સહકાર આપી રહ્યો નથી અને/અથવા આ કરારના નિયમો અને શરતોનું પાલન નથી કરી રહ્યો તેવા કિસ્સામાં રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા (અને/અથવા (૧) ઈમેઈલ દ્વારા (જ્યાં ઈમેલ આઈડી ઉપલબ્ધ છે) અને (૨) એસ.એમ.એસ. અને/અથવા વોટસઅપ (જ્યાં ગ્રાહકનો મોબાઈલ ફોન નંબર ઉપલબ્ધ છે) ગ્રાહકને ઓછામાં ઓછી ૩ (ત્રણ) મહીનાની અગાઉની લેખીત સુચના/નોટીસ જારી કર્યા પછી, આ કરાર અને અહીં આપવામાં આવેલ લાઈસન્સ સમાપ્ત (સમાપ્તિ સુચના) કરવાનો અધિકાર બેંક પાસે ઉપલબ્ધ છે.

- ૩.૨.૨ કરાર રદ/સમાપ્તિની સુચના પ્રાપ્ત થયા પછી, લાયસન્સર/લોકર ધારક તરત જ અને કરાર રદ/સમાપ્તિ સુચના સમર્પણ હેઠળ નિર્ધારિત નોટીસ અવધિની સમાપ્તિ પહેલાં લોકરને ખાલી કરશે અને બેંક દ્વારા પ્રદાન કરવામાં આવેલી ચાવી તથા લોકર ફાળવણી સમયે બેંક દ્વારા આપવામાં આવેલ દસ્તાવજો બેંકને પરત સોંપશે.

૩.૩ લોકરને તોડવું અને તેની સામગ્રી સાથે કામ કરવું:

- ૩.૩.૧ બેંકને આ કરાર હેઠળની જોગવાઈઓ, બેંકની આંતરિક નીતિ(ઓ) અને પ્રક્રિયા(ઓ) અને લાગુ પડતા કાયદાઓ અને નિયમો અનુસાર લોકર તોડવાનો અને તેની સામગ્રીઓ સાથે વ્યવહાર/નિકાલ કરવાનો અધિકાર રહેશે. નીચેની કોઈપણ એક અથવા વધુ ઘટનાઓ—

- (a) અહીના કલોલ ૩.૨.૧ અનુસાર સમાપ્તિની સુચના ગ્રાહકને આપવામાં આવે છે અને ગ્રાહક સમાપ્તિ સુચના હેઠળ નિર્ધારિત નોટીસ અવધિના અંત પછી પણ લોકરને પરત કરતો નથી અને ખાલી કરતો નથી;

- (b) ભાડું સળંગ ૩ (ત્રણ) વર્ષ સુધી બાકી રહે છે; અને

- (c) લોકર ૭ (સાત) વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે નિષ્ક્રિય રહે છે (ભાડું ચૂકવવામાં આવ્યું છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના) અને ગ્રાહક બેંક દ્વારા શોધી શકાતો નથી.

- ૩.૩.૨ લોકર ખોલવાના અધિકારનો ઉપયોગ કરતા પહેલાં, બેંકની સુચિત લોકર તોડવાની કાર્યવાહી (બેંક ઓપન નોટીસ) ની નોટીસ બેંક ગ્રાહક દ્વારા નોંધાયેલ સરનામાં ઉપર રજીસ્ટર પોસ્ટ / સ્પીડ પોસ્ટ દ્વારા ૩ (ત્રણ) મહીનાથી ઓછા નહીં તેવા સમયની લેખીતમાં નોટીસ (ઉપરની કલમ ૩.૨.૧ હેઠળ સમાપ્તિની સુચના ઉપરાંત) (અને ઉપરાંત (૧) ઈમેઈલ દ્વારા (જ્યાં ગ્રાહકનું ઈમેલ આઈડી ઉપલબ્ધ હોય) અને (૨) એસ.એમ.એસ. અને/અથવા વોટસઅપ દ્વારા (જ્યાં ગ્રાહકનો મોબાઈલ ફોન નંબર ઉપલબ્ધ હોય) મોકલશે.

- ૩.૩.૩ તેમ છતાં, લોકર ખોલતા પહેલાં, બેંક આ કરાર હેઠળ સમાયેલ સર્પકો ઉપર, મોબાઈલ પર એસ.એમ.એસ. કરી, ગ્રાહકના સરનામા ઉપર એક વ્યક્તિગત મેસેન્જર મોકલી લેખીત માં જાણ કરવા, ગ્રાહકને લેન્ડ લાઈનફોન પર / મોબાઈલ ફોન પર કોલ્સ કરી ગ્રાહકનો સંપર્ક કરવા શક્ય પ્રયત્નો કરશે.

- ૩.૩.૪ જો બેંક દ્વારા ઉપરોક્ત મુજબની સમાપ્તિની નોટીસ અને બ્રેકીંગ ઓપન નોટીસ ડિલીવરી વિના પરત કરવામાં આવી હોય અથવા બેંકે કલમ ૩.૩.૨ અને ૩.૩.૩ હેઠળ જણાવેલા સહીત વ્યાજબી પ્રયાસો કર્યા હોવા છતાં ગ્રાહકને શોધી ન શકાય તેવા કિસ્સામાં, બેંક લોકર તોડતા પહેલાં લોકર તોડવાના બેંકના ઈરાદા વિશે ઓછામાં ઓછા ૨ (બે) સ્થાનિક અખબારોમાં (એક અંગ્રેજીમાં અને બીજું સ્થાનિક ભાષામાં) જ્યાં ગ્રાહક રહે છે, કરારમાં જણાવ્યા મુજબ અથવા તે ગ્રાહકના સરનામા દ્વારા પુરાવા મુજબ અથવા ગ્રાહક દ્વારા બેંકને જણાવવામાં આવેલ છે, ત્યાં જાહેર નોટીસ આપશે.

- ૩.૩.૫ બેંકના ૨ (બે) અધિકારીઓ અને સાક્ષી તરીકે કામ કરતા ૨ (બે) સ્વંત્ર વ્યક્તિઓની બંનેલી સમિતિની હાજરીમાં લોકર તોડવાનું કામ કરવામાં આવશે.

- ૩.૩.૬ લોકર ખોલવા પર ઉપર દર્શાવેલ પ્રક્રિયાને અનુસરીને બેંક લોકરની સામગ્રીની ઈન્વેન્ટરી તૈયાર કરશે અને બેંકના માન્ય વેલ્યુઅર દ્વારા કરવામાં આવેલ સામગ્રીનું મૂલ્યાંકન કરાવશે અને ટેમ્પર-પ્રુફ રીતે લોકરની સામગ્રીની વિગતવાર ઈન્વેન્ટરી સીલબંધ પરબીડીયામાં ફાયરપ્રુફ સેફની અંદર રાખવામાં આવશે.

- ૩.૩.૭ ઉપરોક્ત ઉપરાંત બેંક ઈન્વેન્ટરી તથા મૂલ્યાંકન સાથે બેંક ઓપન પ્રક્રિયાનો વીડીયો પણ રેકૉર્ડ કરશે અને તેને સુરક્ષિત રાખશે અને સાચવશે જેથી ભવિષ્યમાં કોઈપણ વિવાદ અથવા કોર્ટ કેસ કિસ્સામાં પુરાવા પ્રદાન કરી શકાય.

- ૩.૩.૮ લોકર રજીસ્ટર ઉપરાંત વધુમાં બેંક લોકર તોડવાની વિગતો બેંકની કોર બેંકીંગ સીસ્ટમ (સી.બી.એસ.) અથવા આરબીઆઈ દ્વારા સમયાંતરે જારી કરાયેલ સાચબર સુરક્ષા ફેમવર્ક સાથે સુસંગત અન્ય કોઈપણ કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમમાં દસ્તાવેજીકૃત છે એ પણ સુનિશ્ચિત કરશે.

- ૩.૩.૯ ઉપરના ફકરામાં જણાવ્યા મુજબ તૈયાર કરેલ ઈન્વેન્ટરીમાં નોંધાયેલા લોકરના આર્ટીકલનો નિકાલ જાહેર હરાજીમાં વેચાણ દ્વારા કરવામાં આવશે અને વેચાણની રકમ બેંકને ગ્રાહકના લેણાં માટે પ્રથમ લાગુ કરવામાં આવશે. (બાકી ભાડું, બ્રેકીંગ ઓપન ચાર્જીસ અને અન્ય બાકી લેણાં સહીત) અને બેલેન્સ ગ્રાહકને પરત કરવામાં આવશે અથવા ગ્રાહકના આદેશ પર નિકાલ માટે રાખવામાં આવશે.

- ૩.૩.૧૦ લોકર સમાવિષ્ટોના વેચાણ/ જાહેર હરાજી પહેલાં બેંક નોટીસ દ્વારા લોકર ધારકના રજીસ્ટર્ડ પોસ્ટ/સ્પીડ પોસ્ટ દ્વારા (અને/અથવા (૧) ઈમેઈલ દ્વારા (જ્યાં ઈમેલ આઈડી ઉપલબ્ધ છે) ગ્રાહકને ઓછામાં ઓછી ૩ (ત્રણ) મહીનાની અગાઉની લેખીત સુચના/નોટીસ જારી કર્યા પછી, બેંક દ્વારા ગ્રાહકને લેણાંની વસુલાત માટે લોકરની સામગ્રીની જાહેર હરાજી કરવાના ઈરાદા વીશે બેંક દ્વારા જારી કરવામાં આવશે. બેંક ઉક્ત નોટીસ (ઓકશન નોટીસ) માં હરાજીની તારીખ, સમય, સ્થળ, બેંકની બાકી રકમ અને બનાવવામાં આવેલ લોકરની સામગ્રીની ઈન્વેન્ટરીની નકલ શામેલ કરશે.

૪. બેંકની જવાબદારીઓ અને જવાબદારીઓમાંથી છુટ:

- ૪.૧ વરસાદ, પુર, ભુકંપ, વીજળી, નાગરીક અશાંતિ અથવા હુલ્લડ, રમખાણ અથવા યુધ્ધના કારણે અથવા ત્રાસવાદી હુમલા દ્વારા અથવા અન્ય કોઈ પણ આવા જ કારણ (ણો) દ્વારા લોકરની સામગ્રીને થયેલા નુકસાન અથવા ખરાબી માટે બેંક જવાબદાર રહેશે નહીં.
- ૪.૨ ગ્રાહકની કોઈપણ ભુલ અથવા બેદરકારીને કારણે અને/અથવા તેવા કોઈપણ કૃત્યથી લોકરની સામગ્રીના કોઈપણ નુકસાન / હાનિ માટે બેંક જવાબદાર રહેશે નહીં.
- ૪.૩ આ કરારની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને લોકર તોડવામાં આવે અને તેની સામગ્રીનો વ્યવહાર/નિકાલ કરવામાં આવે તો ગ્રાહક દ્વારા કરવામાં આવેલ કોઈપણ ખર્ચ, નુકસાન અથવા જવાબદારી (કોઈપણ નુકસાન અને/અથવા લોકરની સામગ્રીના નુકસાન સહીત) માટે બેંક જવાબદાર રહેશે નહીં. બેંક તેની જવાબદારીઓમાંથી છુટી જશે.
- ૪.૪ ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લીધા વિના, લોકર પરની બેંકની જવાબદારી હંમેશા લાગુ કાયદા અને નિયમન હેઠળ મર્યાદાને આધીન રહેશે.
- ૪.૫ લોકરની સામગ્રીને બેંક દ્વારા કોઈપણ રીતે વિમો અપાયેલો ગણવામાં આવશે નહીં અને કોઈપણ જોખમ સામે લોકરની સામગ્રીનો વિમો લેવાની બેંકની કોઈ જવાબદારી રહેશે નહીં.

૫. અન્ય

- ૫.૧ સીક્યુરીટી પેટે આપેલ રીપોઝીટ ઉપર બેંકના વ્યવસ્થાપક મંડળ દ્વારા ઠરાવામાં આવેલ દરે વ્યાજ આપવામાં આવશે. જો કોઈ લોકર ધારક ચૂકવવામાં આવેલ વ્યાજની રકમમાંથી ભાડુ ચૂકવવા માંગે તો તે અંગેની સુચના (MANDATE) લોકર ધારક(કો) આપી શકશે.
- ૫.૨ લોકર ભાડે લેનાર(ઓ) બેંક સમયાંતરે અપનાવે, ફેરફાર કરે અથવા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરેલ/ફેરફાર કરેલ સૂચના/નિયમોનું પાલન કરવા સંમત થાય છે.
- ૫.૩ લોકરમાં નામ ફેરફાર, વારસદારના નામમાં ફેરફાર તથા ઓપરેશન અંગેની સુચનામાં ફેરફાર કરવાના સંજોગોમાં તમામ લોકર ધારકોની લેખીત માં સંમતી સહી સહીત હોવી જરૂરી છે.
- ૫.૪ નોંધાવેલ વારસદારનું અવસાન થાય તો આવા સંજોગોમાં મરણના દાખલા સાથે બેંકને તુરંત જાણ કરવાની રહેશે અને અન્ય વારસદારની નિમણૂક કરવાની લેખીત માં જવાબદારી લોકર ધારક(કો)ની રહેશે.
- ૫.૫ સગીર તથા લોકર ધારક સિવાય અન્ય ને પ્રવેશ નિષેધ રહેશે.
- ૫.૬ સરકારી, અર્ધ-સરકારી કે નામદાર કોર્ટના હુકમથી સીલ થયેલ લોકર ઓપરેટ કરવા દેવામાં આવશે નહીં.
- ૫.૭ ઉપરોક્ત કલમ ૫.૧ અન્વયે બેંક મારા/અમારા બચત ખાતા નં _____ માંથી ભાડાની રકમ ડ્યુ તારીખે ઉધારી વસુલ કરી શકશે અને હું/અમો આ બચત ખાતામાં જરૂરી રકમ જમા રાખીશું તેની બાંહેધરી આપું/આપીએ છીએ.

૫.૮ લોકર અંગેના નિયમો તથા વ્યવસ્થાપક મંડળ દ્વારા વખતો વખત તેમાં કરવામાં આવેલ ફેરફાર હું/અમો અમલ કરવા બંધાયેલા છીએ.

૫.૯ મે/અમોએ ઉપર જણાવેલ શરતો વાંચી સમજી લીધી છે અને તે મને/અમોને કબુલ મંજૂર છે. આ કરારની નકલ મને/અમોને બેંક તરફથી મળેલ છે.

૬. કાનુન અને અધિકાર ક્ષેત્ર

આ કરાર ભારતીય કાનુનને આધીન બનાવવામાં આવેલ છે અને તેમાંથી ઉદભવતી સર્વ બાબતો બેંક જ્યાં આવેલી હોય તે સ્થળની અદાલતોના અથવા બેંક જેના હેઠળ આવતી હોય તે અધિકાર ક્ષેત્ર ને આધીન રહેશે.

અનુસૂચિ

સ્થળ:	તારીખ:
૧. આ કરારના પક્ષકારો	
૧-એ	બેંક શાખા
ધી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી. જે કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ, ગુજરાત હેઠળ સંસ્થાપિત અને વડોદરામાં પરિચાલન કરતી નીચે જણાવ્યા મુજબ તેની શાખા મારફત પ્રસ્તુત થાય છે. બ્રાન્ચ: _____	
૧-બી	ગ્રાહક નામ તથા સરનામાં: નામ ૧: CID: સરનામું: Email ID: Telephone Number: _____ Mobile Number: _____ નામ ૨: CID: સરનામું: Email ID: Telephone Number: _____ Mobile Number: _____ નામ ૩: CID: સરનામું: Email ID: Telephone Number: _____ Mobile Number: _____

૨	લોકરની વિગતો	લોકર નંબર:
		ચાવી નંબર:
૩	પ્રતિ વર્ષ લોકરનું ભાડું	રૂા. (અંકડામાં) _____ રૂા. (શબ્દમાં) _____ (સમયાંતરે સુધારો કરવામાં આવે તે મુજબ) (અગ્રિમ ચૂકવવા પાત્ર)
૪	લાઈસન્સની અવધિ	આ કરારની તારીખથી ૧ (એક) વર્ષ જે તેના નિયમો મુજબ સમાપ્ત કરવામાં આવે નહીં ત્યાં સુધી દરેક વખતે આવા એક વર્ષના અંતે વધુ ૧ (એક) વર્ષ માટે સ્વયં વિસ્તૃત રહેશે.
૫	સંચાલન આદેશ	
૬	અન્ય કોઈ નિયમ	
જેની સાક્ષી રૂપે અહીં પક્ષકારોએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.		

ગ્રાહક માટે:			
વિગત	૧	૨	૩
હસ્તાક્ષર:			
નામ:			
હોદ્દો/શ્રમતા:			

(જ્યાં ગ્રાહક બિન-વ્યક્તિગત હોય / રૂબરૂમાં સહી કરનાર વ્યક્તિ ના હોય તેવા કીસ્સામાં)

અહીંના પક્ષકારોએ આ કરારનો અમલ કર્યો છે:

સાક્ષીનું નામ: _____

સરનામું: _____

સાક્ષી તરીકે, હસ્તાક્ષર: _____

બેંક માટે:

શ્રી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી. સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા _____ શાખા

અધિકારીના હસ્તાક્ષર: _____

સહીકરનાર અધિકારીનું નામ: _____

હોદ્દો: _____

બેંકનું સીલ: